

Sixth Session of the India-Norway Joint Commission Meeting

October 13, 2020

ભારત-નોર્વે જોઈન્ટ કમિશનની બેઠકનું છઠ્ઠું સત્ર

ઓક્ટોબર 13, 2020

1. ભારત-નોર્વે જોઈન્ટ કમિશનનું છઠ્ઠું સત્ર 13 ઓક્ટોબર, 2020 નાં રોજ વર્ચુઅલ પ્લેટફોર્મ પર યોજવામાં આવ્યું હતું. નોર્વેનાં પ્રતિનિધિમંડળની આગેવાની નોર્વેનાં વિદેશ મંત્રી મહામહિમ શ્રીમતિ આઈને એરિક્સેન સોરેઈડે અને ભારતીય પ્રતિનિધિમંડળની આગેવાની ભારતનાં વિદેશ મંત્રી મહામહિમ ડૉ. એસ. જયશંકરે કરી હતી.
2. બન્ને મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની તમામ બાબતોની સમીક્ષા કરી હતી અને નોંધપાત્ર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ નોંધ લીધી હતી કે જોન્યુઆરી 2019 માં વડાપ્રધાન એર્ના સોલબર્ગની નવી દિલ્હીની મુલાકાતે ભારત અને નોર્વે વચ્ચે વ્યાપક ભાગીદારી માટેની બ્લૂપ્રિન્ટનો પાયો નાંખ્યો હતો.
3. કોવિડ-19 મહામારીનાં હુમલાએ સમગ્ર વિશ્વનાં દેશો સામે નોંધપાત્ર પડકારો પેદા કર્યા હોવાની નોંધ લેતા, મંત્રીઓએ આ મહામારીનો સામનો કરવા નજીકનો સહકાર આપવાની તેઓની પ્રતિબદ્ધતાનું પુનઃઉચ્ચારણ કર્યું હતું. બન્ને મંત્રીઓએ કોવાક્સ (COVAX) વૈશ્વિક સુવિધાની સ્થાપના અને રસીઓની ઉચિત વૈશ્વિક સુલભતા સુરક્ષિત કરવા તરફનાં કાર્યને આવકાર્યો હતો. બન્ને પક્ષોએ માતા અને બાળકનાં આરોગ્ય પર દ્વિપક્ષીય સહકાર તરફની તેઓની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
4. મંત્રીઓ સંમત થયા હતા કે કોવિડ-19 કટોકટીમાંથી રીકવરી વધારે ટકાઉ અર્થતંત્રોનાં નિર્માણની તક પ્રદાન કરે છે.
5. બન્ને પક્ષોએ વ્યાપાર અને રોકાણ (DTI) પર સંવાદ પર સંતોષ સાથે નોંધ લીધી હતી જેણે ભારતનાં ફ્લેગશિપ પ્રોગ્રામોમાં નોર્વેજિયન કંપનીઓનાં વ્યાપાર સહકાર અને સહભાગીતાને વેગ આપ્યો હતો. DTI ની પ્રથમ બેઠક અન્ય ક્ષેત્રો સાથે મેરિટાઈમ, પ્રવાસન, કૌશલ્ય વિકાસ, માર્કેટ, સ્મોલ અને મીડિયમ સાઈઝ એન્ટરપ્રાઈઝ (MSME) અને રીન્યૂએબલ એનર્જી સમાવતા ઓળખ કરેલા ક્ષેત્રોમાં સહકાર પર નવી દિલ્હીમાં જાન્યુઆરી 2020 નાં રોજ યોજાઈ હતી.
6. બન્ને પક્ષોએ વાણિજ્યિક અને આર્થિક સંબંધમાં અસ્ખલિત સંભાવનાઓ સાકાર કરવામાં દ્વિપક્ષીય વ્યાપાર વિસ્તૃત કરવાની તેઓની પ્રતિબદ્ધતાઓની પુનઃપુષ્ટિ કરી હતી. બન્ને પક્ષોએ ભારત અને EFTA વ્યાપાર વાટાઘાટોનાં વહેલા સમાપન માટે આશા વ્યક્ત કરી હતી.
7. બન્ને પક્ષોએ સમુદ્ર સંવાદ અને ખાસ કરીને માછીમારી, એક્વાકલ્ચર, મેરિટાઈમ વપરાશ માટે ગ્રીન

ટેકનોલોજીઓ, વેસલોનાં નિર્માણ, શિપ રીસાઈકલિંગ અને ગ્રીન પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ભારત અને નોર્વે એમ બન્નેમાં સહકારી સંભાવનાઓનાં ટકાઉ વિકાસ માટે બ્લૂ એનર્જી પરનાં ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. બન્ને પક્ષોએ મરિન પ્રદૂષણ, સંકલિત સમુદ્ર વ્યવસ્થાપન અને સંશોધન અને મરિન વિષયક આયોજનનાં ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલા સુસંગત કાર્ય પર ભાર મૂક્યો હતો. મંત્રીઓએ દીર્ઘકાલીન વૃદ્ધિ અને નોકરીઓનાં નિર્માણ કરવા સાથે મહાસાગરોનું રક્ષણ કરવા બ્લૂ ઈકોનોમી પર સહકાર માટેની સંભાવના પર ભાર મૂક્યો હતો.

8. બન્ને પક્ષોએ મેરિટાઈમ, મરિન હાઈડ્રોકાર્બન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઉચ્ચ શિક્ષણ પર જોઈન્ટ વર્કિંગ ગ્રુપ્સ (JWG) અંતર્ગત હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની નોંધ લીધી હતી. બન્ને મંત્રીઓએ ખાસ કરીને ટકાઉ વિકાસનાં ધ્યેયો હાંસલ કરવા, આબોહવાનાં ફેરફારનો સામનો કરવા અને ગ્રીન ઈકોનોમી તરફ આગળ વધવામાં બન્ને દેશો વચ્ચે સહકાર માટે વેગ અને દિશા આપવા માટે JWGs ની અગત્યતા પર ભાર મૂક્યો હતો.

9. બન્ને મંત્રીઓએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જળવી રાખવામાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રિય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. હવે ભારત અને નોર્વે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં આગામી ચૂંટાયેલા સભ્યો હોવાથી, બન્ને પક્ષોએ 2021-22 સભ્યપદ અવધી દરમિયાન સુરક્ષા પરિષદનાં મુદ્દાઓ પર સીનિય અધિકારીઓનાં સ્તર પર નિયમિત પરામર્શોમાં સામેલ થવા સંમત થયા હતા.

10. બન્ને પક્ષોએ પ્રાંતિય બહુપક્ષીય અને વૈશ્વિક હિતનાં મુદ્દાઓ પર ટ્રિપ્લિકોણોનું આદાન-પ્રદાન કર્યું હતું.

11. બન્ને પક્ષોએ જોઈન્ટ કમિશનની બેઠકનો આગામી રાઉન્ડ પરસ્પર સાનુકુળ તારીખ પર ઓસ્લોમાં યોજવાનું નક્કી કર્યું હતું.

નવી દિલ્હી
ઓક્ટોબર 13, 2020

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.